

બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના બહાને અલગ અલગ ચાર્જ જણાવી ફરીયાદીશ્રીનાઓ સાથે છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડતી, સુરત શહેર સાયબર ક્રાઇમ.

સુરત શહેરના કતારગામ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૦૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, જે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ ફરીયાદીશ્રીને બજાજ ફાયનાન્સ કંપનીમાંથી રૂ.૨૦,૦૦,૦૦૦/- ની લોન અપાવવાની લોભામણી વાતો કરી, બજાજ ફાયનાન્સ કંપનીના નામના બોગસ ઇ-મેઇલ આઇ.ડી. ઉપરથી ફરીયાદીશ્રીને રૂ.૨૦,૦૦,૦૦૦/- ની લોન એપ્રુવ થયેલ હોવાનો બોગસ લેટર મોકલી ફરીયાદીશ્રીને વિશ્વાસ અપાવી અલગ અલગ ચાર્જ જણાવી તેઓની પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ.૮,૬૯,૬૫૨/- ભરાવી ફરીયાદીને લોન ન અપાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો આચરેલ હતો. જે બનાવ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામાં આવતા સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નીતિશકુમાર વિજયકુમાર રહે. બી-૧૪૦, અબુલ ફઝલ એન્કલેવ-૨, શાહીનબાગ, દક્ષિણ દિલ્હીનો હોવાનું જણાઇ આવતા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી જે.બી.આહીર તથા એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ તખતસિંહ તથા અ.પો.કો. યોગેશભાઇ ચંદુભાઇ તથા લોકરક્ષક નાજભાઇ જેઠુરભાઇ નાઓને દિલ્હી ખાતે તપાસમાં મોકલતા તેઓએ સદર આરોપી નીતિશકુમાર વિજયકુમાર મીશ્રા ઉ.વ.૨૪ ધંધો-બેકાર રહે. ધર નં.૨૫૪, લખપત કોલોની, વિભાગ-૨, કિંપાલઅવાના કોઠી પાસે, બદરપુર, ન્યુ દિલ્હી-૧૧૦૦૪૪ મુળ રહે.ગામ-તુર્કી, ભટોલીયા થાના-મીનાપુર, જી.મુઝફ્ફરપુર (બિહાર) નાને શોધી કાઢેલ અને તેને અત્રે સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે લઇ આવતા તેની પુછ પરછ કરતા તે ફેબ્રુઆરી-૨૦૧૯ થી જુલાઇ-૨૦૧૯ સુધી બીજો માળ, ડી.ડી.એ. ફ્લેટ, પુલ પ્રહલાદપુર, રેડ લાઇટ પાસે, ન્યુ દિલ્હી ખાતે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતો હતો અને કોલરો રાખી, અલગ અલગ કસ્ટમરોને ફોન કરી, લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા હતા અને આ કામના ફરીયાદીશ્રી પાસેથી લોન અપાવવાના બહાને અલગ અલગ ચાર્જ જણાવી રૂ.૮,૬૯,૬૫૨/- પોતાના તથા પોતાના ભાઇ જીતેશકુમાર મીશ્રાના બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ હોવાની કબુલાત કરેલ છે. આ રીતે ઉપરોક્ત વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.